

મોબાઈલ સ્નેચીંગ કરતી ગેંગને ઝડપી પાડી, મોબાઈલ સ્નેચીંગના ગુનાઓના ભેદ ઉકેલી નાંખતી

કાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી.

શહેર વિસ્તારમાં બનતા મોબાઈલ સ્નેચીંગના બનાવો અંગે કાઈમ બ્રાંચ/એસ.ઓ.જી.ના અધિકારીશ્રીઓ તેમજ પો.માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપીઓ (૧) સલમાન ઉર્ફે સલમાન રેડીયમ ડ/૦ અબ્દુલ રઝાક શેખ ઉ.વ.૨૧ રહેવાસી- અકબર શહીદનો ટેકરો, મુલતાનીના ડેલા, કાલીપુર, આંબાવાડી, સલાબતપુરા, સુરત (૨) શરીફ ઉર્ફે બાબુ ડ/૦ કમરૂદીન અન્સારી ઉ.વ.૨૬ રહેવાસી- ઉમરવાડા ચીમની ટેકરા હળપતી કોલોની, રૂમ નં.૩૬, સાંઈ મેડીકલની પાછળ સલાબતપુરા, સુરત (૩) કૈયુમ ઉર્ફે લાલો ચૈયુબ પટેલ ઉ.વ.૨૨ રહેવાસી- પ્લોટ-૩૪, ગલી નં.૨, મટન માર્કેટની પાસે, કિન્નરી સિનેમાની સામે, સલાબતપુરા, સુરત નાઓને ભાઠેના, વાડીવાલા બાવાની દરગાહ પાસેથી ઝડપી પાડી, મજકુર ત્રણેય આરોપી ઈસમો પાસેથી જુદી-જુદી કંપનીના કુલ મોબાઈલ નંગ-૮ કુલે કિ.રૂ. ૫૫,૫૦૦/- તથા એક નંબર વગરની સ્પેન્ડર પ્લસ મો.સા. કિ.રૂ. ૬૦૦૦૦/- મળી કુલે રૂ.૧,૧૫,૫૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબજે લીધેલ છે.

મજકુર આરોપીઓની પુછપરછમાં ત્રણેય ખાસ મિત્રો છે અને હાલ બેકાર હોય, ત્રણેય જણાએ ભેગા મળી રસ્તા ઉપર મોબાઈલ ફોન ઉપર વાત કરતા ચાલતા જતા રાહદારીઓના મોબાઈલ ફોનો આસાનીથી સ્નેચીંગ કરી શકાતા હોય, જેથી આરોપી નં.૧, સલમાન ઉર્ફે સલમાન રેડીયમની વગર નંબરની સ્પેન્ડર પ્લસ મો.સા. ઉપર બેસી આરોપી નં.૧ તથા ૨ નાઓએ છેલ્લા દોઢ માસથી રસ્તે ચાલતા જતા રાહદારીઓના મોબાઈલ ફોનો સ્નેચીંગ કરવાનું શરૂ કરેલ અને આરોપી નં.૩, કૈયુમ ઉર્ફે લાલો ચૈયુબ પટેલ આ મોબાઈલ ફોનો વેચી આપવાનું જણાવેલ હોય આજરોજ ત્રણેય જણા આ મોબાઈલ ફોન વેચી દેવા માટે ભેગા થયેલ હતા. આ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડેલ છે. આરોપીઓ પાસેથી કબજે લીધેલ મોબાઈલ ફોનો પૈકી શહેર વિસ્તારમાં ઉઘના પો.સ્ટે.ની એક લુંટ તેમજ સલાબતપુરા પો.સ્ટે.ના બે અને પાંડેસરા પો.સ્ટે.ના એક એક મોબાઈલ સ્નેચીંગના ગુનાઓનો ભેદ ઉકેલાયેલ છે.

મજકુર પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી શરીફ ઉર્ફે બાબુ ડ/૦ કમરૂદીન અન્સારી તથા કૈયુર ઉર્ફે લાલો ચૈયુબ પટેલા નાઓ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હાઓમાં પકડાઈ ચુકેલ છે. આમ કાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી. ટીમ દ્વારા લુંટનો વણશોધાયેલ ગુન્હે શોધી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.